



PBK-16080001010200 Seat No. _____

B. Com. (Sem. I) (CBCS) Examination

November / December - 2018

Principles of Micro Economics - 1

(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.
 (૨) જરૂર જણાય ત્યાં આલેખ દોરો.
 (૩) જમણી બાજુ દર્શાવેલ અંક ગુણ દર્શાવે છે.

૧ ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું ? ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને ૨૦
 કાર્યક્ષેત્ર વર્ણવો.

અથવા

૧ (અ) વટાવનો સિદ્ધાંત સમજાવો. ૧૦
 (બ) વૃદ્ધિનો ઘ્યાલ સમજાવો. ૧૦

૨ માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું ? માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની રીતો ૨૦
 વિગતે સમજાવો.

અથવા

૨ (અ) માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો સમજાવો. ૧૦
 (બ) માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબળો સમજાવો. ૧૦

૩ ઉત્પાદન વિધેય એટલે શું ? ઘટતા ભળતરનો નિયમ ઉદાહરણ તથા ૧૫
 આલેખની મદદથી સમજાવો.

અથવા

૩ વહેચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત વિગતે સમજાવો. ૧૫

૪ ટૂંકાગાળામાં સરેરાશ અને સીમાંત ખર્ચના ઘ્યાલો સમજાવી બન્ને વર્ણેના ૧૫
 આંતરસંબંધો આલેખની મદદથી સમજાવો.

અથવા

૪ (અ) સમઉત્પાદન વકનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ૮
 (બ) લાંબાગાળામાં પેઢીના ખર્ચ અંગેનો આધુનિક સિદ્ધાંત સમજાવો. ૭

ENGLISH VERSION

Instructions :

- (1) All questions carry equal marks.
- (2) Draw diagram if necessary.
- (3) Figures to the right indicate marks.

1 What is business economics ? Explain the nature and scope of business economics. **20**

OR

1 (a) Explain the principle of discount. **10**
(b) Explain the incremental concept. **10**

2 What is price elasticity of demand ? Explain the methods of measuring the price elasticity of demand. **20**

OR

2 (a) Explain the kinds of price elasticity of demand. **10**
(b) Explain the factors affecting the price elasticity of demand. **10**

3 What is the meaning of production function ? Explain with illustration and diagram the law of diminishing return in the short run. **15**

OR

3 Explain in detail the marginal productivity theory of distribution. **15**

4 Explain and illustrate the interrelations between average cost and marginal cost in the short run with help of diagram. **15**

OR

4 (a) Explain the meaning and characteristics of Iso-quant curve. **8**
(b) Explain the modern theory of production cost of firm in the long run. **7**
